

કલમ-૪(૧)(બી)(૨) :- સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો :-

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય એકાઉન્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીની કામગીરીની વિગતો દર્શાવતું પત્રક

અ.નં.	હોદ્દો	કામગીરીની ટૂંકી વિગત
૧	નાયબ હિસાબનીશ	<ul style="list-style-type: none"> ➢ આરોગ્ય વિભાગમાં અંદાજપત્ર બનાવવાની તેમજ ખર્ચ અને આંકડાકીય માહિતીની કામગીરી. ➢ આરોગ્ય ખાતાના બીલોની કામગીરી તથા હિસાબી ખાતા સાથે સંકલન, ઓડિટ ઓફિશિયલ રીપોર્ટ અને કાર્યક્રમની પ્રસ્તાવના પત્રક. ➢ RTI એકટ અંતર્ગત એકાઉન્ટ સંબંધિત જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી. ➢ ઉપરી અધિકારીઓ દ્વારા સુચવવામાં આવતા અન્ય કાર્ય. ➢ ઈ-એકાઉન્ટની ગઠન તૈયાર થયેલ આરોગ્ય ખાતામાં તાબા હેઠળનાં તમામ ખાતાઓની બીલોની ચકાસણી કરવી.
૨	હેડ કલાર્ક	<ul style="list-style-type: none"> ➢ તાબા હેઠળના કર્મચારીઓની કામગીરી પર દેખરેખ તેમજ હાજરીને લગતી કામગીરી. ➢ રીટિભર્સને લગતી અને મેયર્સફર્ડમાંથી સહાય અંગેની દરખાસ્ત તેમજ આરોગ્ય એકાઉન્ટ વિભાગમાંથી પ્રસ્તાવના પત્રક. ➢ સી.ક્ર્યુ. /જી.સંકલન, અને નાગરિક અધિકારીઓની ચકાસણી કરવી. ➢ મેરીકલ રી-ઈમ્બર્સ સંબંધિત તમામ કામગીરી
૩	સીની. કલાર્ક	<ul style="list-style-type: none"> ➢ આરોગ્ય ખાતાના તમામ ખાતાકીય દસ્તાવેજોની આઉટવર્ડ અને ઈનવર્ડની કામગીરી.
૪	સીની.કલાર્ક	<ul style="list-style-type: none"> ➢ સુ.મ.પા.ના સેન્ટ્રલ ઝોન, કતારગામ ઝોન, રાંદેર ઝોન અને ઉધના ઝોન ની હદ વિસ્તારમાં રહેતાં ગરીબ, નિરાધાર, અપંગોની માંદગી અંગેના કિસ્સાઓમાં મેરીકલ રીપોર્ટ તથા અરજદારની આર્થિક સ્થિતિ ધ્યાનમાં લઈ જે તે સમયે કેસની ગુણવત્તા જોઈ તેની ચકાસણી કર્યાબાદ મેયર્સફર્ડ સમિતિ તરફથી મંજૂર કરેલ સહાય મુજબ સક્ષમ સત્તાની મંજૂરી મેળવી પેમેન્ટ માટેની કાર્યવાહી તથા હિસાબોની મેળવણીની કામગીરી. ➢ આર.ટી.આઈ. ને લગતી તમામ પ્રકારની કામગીરી.
૫	સીની.કલાર્ક	<ul style="list-style-type: none"> ➢ સુ.મ.પા.ના વરાધા ઝોન, અઠવા ઝોન અને લિંબાયત ઝોનની હદ વિસ્તારમાં રહેતાં ગરીબ, નિરાધાર, અપંગોની માંદગી અંગેના કિસ્સાઓમાં મેરીકલ રીપોર્ટ તથા અરજદારની આર્થિક સ્થિતિ ધ્યાનમાં લઈ જે તે સમયે કેસની ગુણવત્તા જોઈ તેની ચકાસણી કર્યાબાદ મેયર્સફર્ડ સમિતિ તરફથી મંજૂર કરેલ સહાય મુજબ સક્ષમ સત્તાની મંજૂરી મેળવી પેમેન્ટ માટેની કાર્યવાહી તથા હિસાબોની મેળવણીની કામગીરી. ➢ આરોગ્ય ખાતા તાબા હેઠળના સ્વચ્છ ભારત મિશન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવતા પેમેન્ટ અંગેના કેપીટલ/રેવન્યુ ખર્ચના તમામ બિલો તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના રૂદરપુરા સ્ટોર્સ ખાતેથી પેમેન્ટ માટે રજૂ કરવામાં આવતા તમામ બિલોની ચકાસણી અને તે સંબંધિત ખર્ચની જાળવણી અંગેના રજીસ્ટર્સને મેઇનટેઇન કરવાની કામગીરી
૬	સીની. કલાર્ક	<ul style="list-style-type: none"> ➢ સફાઈ કામદારોને ફાળવવામાં આવતા કવાટર્સ તેમજ આરોગ્ય ખાતા હસ્તકના કવાટર્સ ફાળવવા કખજો લેવા તેમજ તે સંબંધિત તમામ રેકર્ડ ની જાળવણી કરવાની કામગીરી ➢ આઈ.સી.ડી.એસ.ના તમામ ઘટકોના બીલોની ચકાસણી
૭	સીની. કલાર્ક	<ul style="list-style-type: none"> ➢ સુરત મહાનગરપાલિકાના ફરજ બજાવતા કર્મચારીઓ/ પેન્શનરો/ મ્યુ. કાઉન્સીલરો તેમજ તેઓના આશ્રિતોને અરજી કર્યે થી મેરીકલ રીએમ્બર્સમેન્ટ કરવાની તમામ કામગીરી
૮	સીની. કલાર્ક	<ul style="list-style-type: none"> ➢ સુરત મહાનગર પાલિકા સંચાલિત તમામ અર્બન હેલ્થ સેન્ટર / અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમનાં આવતાં કર્મચારી, અધિકારીઓ તથા તેમનાં આશ્રિતો તથા મ્યુ. સદશ્યશ્રીને

		<p>અર્બન હેલ્પ સેન્ટર / અર્બન હેલ્પ સેન્ટર અને મે.ડોમ ખાતેથી બહારથી પ્રિસ્કાઈફ કરવામાં આવતી દવાઓ/ઇન્જેક્શનો પ્રિસ્કીપશન પર આપવા માટે સુરત શહેર વિસ્તારના મેડીકલ સ્ટોર્સ ને એપ્રેવલ આપવા સંબંધિત ટેન્ડર પ્રસિદ્ધ કરવાની કામગીરી</p> <ul style="list-style-type: none"> ➤ સુરત મહાનગર પાલિકા સંચાલિત તમામ અર્બન હેલ્પ સેન્ટર / અર્બન હેલ્પ સેન્ટર અને મેટરનીટી ડોમનાં આવતાં કર્મચારી, અધિકારીઓ તથા તેમનાં આંકિતો તથા મ્યુ. સદશ્યશ્રીને મળતી વૈદ્યીય રાહતનાં લાલ કેસનાં બીલો જે માન્ય મેડીકલ સ્ટોરમાંથી આવે છે તે અંગે હેલ્પ સેન્ટર તરફથી રજુ કરવામાં આવતા પેમેન્ટનાં બીલો ની ચકાસણી કરી બીલ રજીસ્ટરમાં નોંધ કરી મુખ્ય હિસાબનીશ વિભાગમાં મોકલવાની કામગીરી ➤ આરોગ્ય અધિકારીશ્રીને ફાળવેલ પર્સનલ એડવાન્સ સાચવવાની અને જાળવણી કરવાની કામગીરી
૮	કલાર્ક ક્રમ ક્રમ્પા.આસી.	<ul style="list-style-type: none"> ➤ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતાનાં બજેટ સેન્ટર કોડ-૮૧/૮૩ ના તમામ પ્રકારનાં રેવન્યુ ખર્ચ/કેપીટલ ખર્ચ/ફાઈનલ બીલોની પ્રથમ લેવલની ચકાસણી કરવાની કામગીરી. ➤ જાહેર આરોગ્યખાતા સંચાલિત તમામ અર્બન હેલ્પ સેન્ટર/અર્બન હેલ્પ સેન્ટર અને મેટ.ડોમના ઉપયોગ માટેના તમામ પ્રકારની સર્જીકલ આઈટમો/ફર્નિચર/ફિક્ચર્સ/ઇલે.આઈટમો વિગેરે ખરીદી અને રીપેરીંગ અંગેની કામગીરી. ➤ ઉપરી અધિકારીશ્રીની સૂચના મુજબ આરોગ્યવિભાગના તાબા હેઠળના જુદા જુદા વિભાગોના ટેન્ડર બનાવી પ્રસિદ્ધ કરવાની કામગીરી. ➤ સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ ખાતે ઉપલબ્ધ ન હોય અને અત્યંત જરૂરી હોય તેવી દવાઓ/ઇન્જે. વિગેરે ખરીદ કરી પૂરી પાડવા અંગેની કામગીરી. ➤ નવા ઉપસ્થિત કરવામાં આવતા અર્બન હેલ્પ સેન્ટર/અર્બન હેલ્પ સેન્ટર અને મેટ. ડોમના ઉપયોગ માટે સર્જીકલ આઈટમો/ફર્નિચર વિગેરે પૂરા પાડવા અંગેની કામગીરી. ➤ બજેટ બનાવવાની કામગીરી ➤ બજેટ / જનરલ એડવાન્સ / ઓડિટ ઓફિઝેક્શનની કામગીરી. ➤ ઉપરી અધિકારીશ્રી તરફથી સોંપવામાં આવતી અન્ય તમામ કામગીરી.
૯૦	તાલી.કલાર્ક	<ul style="list-style-type: none"> ➤ આરોગ્ય ખાતાનાં તાબા હેઠળના બજેટ સેન્ટર કોડ-૮૧/૮૩ અને ૮૧/૫૦ સિવાયનાં તમામ બજેટ સેન્ટરોનાં વેપારી બીલો/રેવન્યુ/કેપીટલ ખર્ચ/ટી.એ.ડી.એ. અંગેની બીલોની દિનિય લેવલની ચકાસણી કરવાની કામગીરી. ➤ આરોગ્યવિભાગનાં તાબા હેઠળના તમામ વિભાગોની તમામ પ્રકારની આવકો લઈ તેની કોમ્પ્યુ.રસીદ બનાવવાની તેમજ તે અંગેનું ભરણું મુખ્ય હિસાબનીશ વિભાગમાં જમા કરાવવાની કામગીરી. ➤ એસ.ટી.ડી.કેર પ્રોજેક્ટના બીલોની બીજા લેવલની ચકાસણી ➤ માર્કેટ ખાતાના બજેટ સેન્ટર કોડ - ૮૧/૧૦, ૮૧/૧૧ ના બીલોની બીજા લેવલની ચકાસણી ➤ તમામ અ.ડે.સે.ના ટી.એલ. ના બીલોની બીજા લેવલની ચકાસણી ➤ વી.બી.ડી.સી.વિભાગ,કુડ વિભાગ, પબ્લિક હેલ્પ લેબોરેટરી, લેપ્રેસી કંટ્રોલ યુનિટ વિ.વિભાગોના પેમેન્ટ માટે રજુ કરવામાં આવતા બીલોની બીજા લેવલની ચકાસણી ➤ આરોગ્ય ખાતાના તાબા હેઠળના તમામ વિભાગોના ટી.એ.ડી.એ. ના બીલની ચકાસણીની કામગીરી ➤ તમામ બીલો ઈ-એકાઉન્ટિંગથી તૈયાર થયેલ જેણું બીજા લેવલની ચકાસણી કરવાની કામગીરી.
૯૧	તાલી. કલાર્ક	<ul style="list-style-type: none"> ➤ તમામ હેલ્પ સેન્ટરોનાં મેડીકલ ઓફિસરશ્રીનાં પર્સનલ એડવાન્સના બીલો/ ફી ના બીલો/ લાઈટ બીલો/ ધોખીના બીલો વિગેરે બજેટ સેન્ટર ૮૧/૫૦ તેમજ સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ ખાતેથી રજુ કરવામાં આવતા તમામ બીલોની ચકાસણી કરવાને લગતી કામગીરી ➤ હેલ્પ સેન્ટરોના માનદ ડોક્ટરોના બીલોની ચકાસણી
૯૨	તાલી. કલાર્ક	<ul style="list-style-type: none"> ➤ આરોગ્ય ખાતા હસ્તકના તમામ ખાતાઓ /અ.ડે.સે. અને વિભાગીય કચેરી માટે સેન્ટ્રલ સ્ટોર

		<p>ખાતેથી સ્ટેશનરી લાવવાની તેમજ તેનો વહેંચણીની કામગીરી</p> <ul style="list-style-type: none"> ➢ તબીબી સારવાર પુસ્તિકા નવી બનાવવાના તમામ ફોર્મની ચકાસણી કરી પુસ્તિકા બનાવવાની કામગીરી તથા તબીબી સારવાર પુસ્તિકામાં તમામ પ્રકારના સુધારા/ વધારા કરવાની કામગીરી ➢ લીનન આર્ટિકલ્સની ખરીદી અને તેને ઈસ્યુ કરવાની કામગીરી તથા બીલની કામગીરી. ➢ તમામ અ.ડે.સે. માટે જાહેર બજારમાંથી જરૂર મુજબની સ્ટેશનરી ખરીદી કરી આપવાની તથા તેના બીલોની કામગીરી ➢ આરોગ્ય ખાતામાંથી ખરીદી કરીને ફળવવામાં આવતા આયાઓના ગણવેશ ની સંબંધિત ખાતાઓને વહેંચણી કરવી.
૧.૩	તાલી. કલાર્ક	<ul style="list-style-type: none"> ➢ બી.સી.એન.ડી.૮૧/૮૩ તેમજ સ્વચ્છ ભારત મિશનના નાં બીલો ની ચકાસણી સંબંધે સીની. કલાર્ક સાથે સંયુક્ત કામગીરી
૧.૪	તાલી.કલાર્ક	<ul style="list-style-type: none"> ➢ શ્રી-ઈમ્બર્સ્મેન્ટ ને લગતી કામગીરી